

રિસાલતુલ હુકુક

(અધિકારો અને ફરજોની લેખિત સનદ)

(Treatise of Rights) (Charter of Rights)

ઈમામ જૈનુલ આબેદીન (અ.) એ બયાન
ફરમાવેલ અધિકારો અને ફરજોનું વર્ણન

: પ્રકાશક :

HADI LIBRARY

ગુજરાતી પુસ્તકાલય

www.hadilibrary.org

કિતાબનું નામ	:	રીસાલતુલ હુકુક
વિષય	:	આપણી જવાબદારીઓ અને બીજાના અવિકારો
અસલ બયાન	:	ઈમામ જૈનુલ આબેદીન(અ.)
ગુજરાતી અનુવાદ :		રજા સોનગઢવાળા
પ્રુફ રીડીગ	:	મૌ. મુરતજા મોરબીવાળા
હંદિયો	:	અમલ
ઈ-પબ્લિશર	:	www.hadilibrary.org
ઈ-આવૃત્તિ	:	એપ્રિલ-૨૦૧૮

બિસ્મીલ્હાહિ રહેમાનિ રહીમ

પ્રસ્તાવના

‘રિસાલતુલ હુકુક’નું વર્ણન શૈખે સદુકની કિતાબો ‘અલ બિસાલ’, ‘અલ આમાલી’ અને ‘મન લા યહ્ઝોરોહુલ ફકીહ’માં જોવા મળે છે, જેના સૌપ્રથમ રાવી (બયાન કરનાર) અબુ હઝા સેમાલી છે, જે ઈમામ જૈનુલ આબેદીન(અ.)ના ભરોસાપાત્ર અને આદરણીય સાથીદાર (સહાબી) હતાં.

આપણી જવાબદારીઓ અને ફરજો કઈ—કઈ છે અને બીજાના અધિકારો અને હકો કયા—કયા છે તેનું વર્ણન આ પુસ્તકામાં ટૂંકમાં છતા ઉંડાણપૂર્વક કરી દેવામાં આવેલ છે, જે મન્દુસ્થુમ ઈમામના કલામની ખૂબી અને વિશિષ્ટતા દર્શાવે છે.

આ પુસ્તકા અંગ્રેજમાંથી ગુજરાતીમાં રૂપાંતર કરવામાં આવી છે. ગુજરાતી ભાવાનુવાદ કરતી વખતે

શક્ય તમામ કાળજી લેવામાં આવી છે, આમ છતા
કાંઈ ભૂલ કે ક્ષતિ નજરે પડે, તો ધ્યાન દોરવા વિનંતી.

આ પુસ્તિકાનું ખુફ્ફ રીડીગ અને સુધારા—વધારા
કરી આપનાર મૌ. મુરતજા મોરબીવાળાનો આભાર
વ્યક્ત કરતા અલ્લાહ પાસે દુઅા છે કે અલ્લાહ તેમની
તૌફીકાત અને તંદુરસ્તીમાં વધારો કરે.

આ પુસ્તિકાને ઈમામે જમાના(અ.)ની
ખિદમતમાં અર્પણ કરતા અલ્લાહ તાલાલાને દુઅા છે
કે તે આ નાનકડી કોશિશને કબૂલ ફરમાવે અને તેને
અમારા માટે આખેરતનો શાણગાર અને સવાબે
જારીયાનું માધ્યમ બનાવી દે.

ગુજરાતી અનુવાદક

બિસ્મીલ્હાહિ રહમાનિ રહીમ

અનુક્રમણિકા

Contents

પ્રસ્તાવના	3
અનુક્રમણિકા.....	5
૧. અલ્હાહનો હક.....	9
૨. નફસનો હક	10
૩. જિભનો હક.....	11
૪. કાનનો હક	12
૫. આંખનો હક.....	12
૬. પગનો હક	13
૭. હાથનો હક	14
૮. પેટનો હક.....	15
૯. ગુપ્તઅંગો (શર્મગાહ)નો હક	16

૧૦. નમાજનો હક	17
૧૧. રોજાનો હક	18
૧૨. હજનો હક	19
૧૩. સંદર્ભનો હક	19
૧૪. કુરબાનીના જાનવરનો હક	21
૧૫. રાજી / સત્તાધીશ / શાસકનો હક	22
૧૬. શિક્ષકનો હક	24
૧૭. માલિકનો હક	25
૧૮. પ્રજા / જનતાનો હક	26
૧૯. વિદ્યાર્થીનો હક	27
૨૦. પત્નિનો હક	28
૨૧. ગુલામનો હક	30
૨૨. માતાનો હક	31
૨૩. પિતાનો હક	33
૨૪. સંતાનનો હક	34

૨૫. ભાઈનો હક	35
૨૬. આજાદ કરનાર માલિકનો હક	36
૨૭. આજાદ કરવામાં આવેલ ગુલામ(નોકર)નો હક	38
૨૮. ભલાઈ કરનારનો હક	39
૨૯. અજાન આપનારનો હક	40
૩૦. નમાઝ પઠાવનાર (પેશઈમામ)નો હક	41
૩૧. સાથે બેસનારનો હક	43
૩૨. પાડોશીનો હક	44
૩૩. મિત્રનો હક	45
૩૪. ભાગીદાર(પાર્ટનર)નો હક	47
૩૫. માલ-દૌલતનો હક	48
૩૬. કર્જ આપનારનો હક	50
૩૭. સહકાર્યકરનો હક	51
૩૮. દાવો કરનાર(વાદી)નો હક	52

૭૯. જેની ઉપર દાવો માંડવામાં આવ્યો છે તે (પ્રતિવાદી)નો હક.....	53
૮૦. સલાહ માંગનારનો હક	54
૮૧. સલાહ આપનારનો હક.....	55
૮૨. નસીહત (ઉપદેશ) માંગનારનો હક	57
૮૩. નસીહત (ઉપદેશ) આપનારનો હક	58
૮૪. મોટાનો (વડીલનો) હક.....	59
૮૫. નાની વયની વ્યક્તિત્વનો હક	60
૮૬. માંગણી કરનારનો હક	61
૮૭. જેની પાસે માંગણી કરવામાં આવે તેનો હક .	62
૮૮. ખુશ કરનારનો હક	63
૮૯. દુઃખ પહોંચાડનારનો હક	65
૯૦. મુસલમાનોનો હક.....	67
૯૧. બિનમુસ્લિમોનો હક	69

બિસ્મીલ્હાહી રહેમાનિ રહીમ

ઈમામ જૈનુલ આબેદીન(અ.)એ કુલ એકાવન
હકો (અધિકારો) બયાન ફરમાવેલ છે, જે 'રિસાલતુલ
હુકુક' તરીકે ઓળખાય છે અને તે નીચે મુજબ છે:

વિભાગ (અ): અલ્લાહનો હક

૧. અલ્લાહનો હક

તમારી પર અલ્લાહનો હક (અધિકાર) એ છે કે
તમે તેની ઈબાદતમાં કોઈને શરીક (ભાગીદાર) કર્યા
વિના ફક્ત તેની જ ઈબાદત કરો. જો તમે તે ફરજ
ખુલુસતાથી અદા કરશો, તો અલ્લાહે તમારા માટે
દુનિયા અને આખેરતની બાબતોમાં પૂરતું અતા
કરવાની અને તમને આ દુનિયા અને આખેરતમાં
તમારી મનપસંદ ચીજોને તમારા માટે સુરક્ષિત
રાખવાની જવાબદારી લીધી છે.

વિભાગ (બી): નફસનો અને શરીરના અંગોનો હક

૨. નફસનો હક

અને તમારો પોતાનો (તમારા નફસનો) તમારી ઉપર એ હક છે કે તમે તેનો ઉપયોગ પૂર્ણપણે અલ્લાહની ઈતાઅતમાં લગાડીને કરો, તમારી જબાનને તેનો હક પહોંચાડીને, અને તમારા કાનને તેનો હક અતા કરીને, અને તમારી દ્રષ્ટિને તેનો હક આપીને, અને તમારા હાથને તેનો હક આપીને, અને તમારા પગને તેનો હક સુપરત કરીને, અને તમારા પેટનો હક અદા કરીને. અને તમારા ગુપ્ત અંગનો હક અદા કરીને, અને આ બધા (હકોની અદાયગી) માટે તમે અલ્લાહની મદદ માંગો.

૩. જિભનો હક

અને જબાનનો હક એ છે કે તમે તેને અશિષ્ટ અને અશ્વલીલ ભાષાના ઉપયોગથી દૂર રાખો. અને તેને સુંદર (ભાષા) માટે કેળવો, અને તેને અદબ (સંસ્કાર) વડે શિસ્તબદ્ધ કરો, અને જરૂરતના સમયે તથા દીન અને દુનિયાના લાભ મેળવવા સિવાય તેને ખામોશ રાખો. અને તેને હુણુલ (નકામી અને વધારાની) વાતો કરવાથી અટકાવો, જે થોડાં ફાયદાની સાથે ઘણા બધા નુકસાનનું કારણ બની શકે છે. આ બાબત અક્કલ અને નકલ (વર્ણન) બંનેથી સાબિત છે. અક્કલમંદની ખૂબસુરતી તેની ભલી અને સારી વાતોમાં છે. અલ્લાહ સિવાય કોઈ તાકત કે શક્તિ નથી.

૪. કાનનો હક

અને કાનનો હક એ છે કે તમારા કાનને તમારા દિલના માર્ગ તરફ (જવાનો રસ્તો) ન બનાવો, સિવાય કે ઉમદા વાતો, જે તમારા દિલમાં કંઈક ભલાઈ પેદા કરે, અથવા તમારા માટે ઉમદા અખ્લાક મેળવી આપે. કારણ કે ખરેખર કાન એ દિલ તરફનો દરવાજો છે, જે જુદા—જુદા પ્રકારની વાતોને તેની તમામ ભલાઈ અથવા બુરાઈની સાથે દિલમાં પ્રવેશવાની મંજૂરી આપે છે, જુદા—જુદા પ્રકારના વિચારો લઈ જવાની, ભલેપદ્ધી તે સારા હોય કે ખરાબ. અલ્લાહ સિવાય કોઈ તાકત કે શક્તિ નથી.

૫. આંખનો હક

અને તમારી આંખનો એ હક છે કે તમે તેને એવી દરેક ચીજ સામે ઝુકાવીને રાખો, જેને જોવાની

તમને મંજૂરી નથી. અને તમે તેનો ઉપયોગ ન કરો
સિવાય કે એવી જગ્યાએ જે તમને બોધપાઠ
(શિખામણ / ઈદ્વત) આપે અથવા જેના થકી તમારા
જ્ઞાનમાં વધારો થાય અથવા બસીરત (ઉડી સમજણ)
હાંસિલ થાય, કારણ કે બેશક આંખ એ શિખામણ
અને ઈદ્વતનો દરવાજો છે.

૬. પગનો હક

અને તમારા બંને પગનો એ હક છે કે, તમે તેના
વડે ચાલીને તે તરફ ન જાવ, જેની તમને મનાઈ
કરવામાં આવી છે. અને તે બંને (પગ)ને કલંકિત
માર્ગ ઉપર પસાર થવા માટેની તમારી સવારી ન
અનાવો, કારણ કે તમારા પગ તમારા પરિવહન
(આવન—જાવન માટે)ના સાધન છે અને તમને દીન

અને પ્રગતિના પંથે લઈ જનાર છે. અલ્લાહ સિવાય
કોઈ તાકત કે શક્તિ નથી.

૭. હાથનો હક

અને તમારા હાથનો એ હક છે કે તમે તેને તે
તરફ ન લંબાવો, જે તમારા માટે હલાલ નથી.
નહિંતર તમે આખેરતમાં અલ્લાહ તરફથી સજા
મેળવશો અને આ દુનિયામાં લોકોની ટીકા પ્રાપ્ત
કરશો. અને અલ્લાહે તમારી ઉપર વાળું કરેલા
કાર્યોની અદાયગીથી તમારા હાથોને અટકાવો નહિં.
બલ્કે તમે તમારા હાથને નેક કામોમાં વધારે મશગૂલ
રાખી આદર—સત્કારમાં વધારો કરો. જે કાર્યોમાં
હાથોને કાર્યરત રાખવાની મનાઈ કરવામાં આવી છે
તેનાથી તેમને દૂર રાખીને અને તેમને ભલાઈના કાર્યો
માટે આજાદ રાખો. આ રીતે તમે દુનિયામાં માનવંત

બનશો અને આખેરતમાં સારો બદલો પ્રાપ્ત કરી શકશો.

૮. પેટનો હક

અને તમારા પેટનો તમારી ઉપર એ હક છે કે, તમે તેને હરામ ચીજોનું વાસણ ન બનાવો, ભલે પછી તે ચીજ થોડી હોય કે વધારે. અને એ કે તમારે હલાલ ચીજો પણ વધુ ન ખાવી જોઈએ, કારણ કે ખોરાક શક્તિ મેળવવા માટે ખાવાનો હોય છે. અને તમારે પેટ ભરવાની ચિંતામાં ન રહેવું જોઈએ. (ખાવા—પીવા બાબતે) બીજાઓની અદેખાઈ ન કરવી જોઈએ, બલ્કે ઈન્સાફથી કામ લેવું જોઈએ. વધુ પડતો ખોરાક આળસનું કારણ બને છે, કામ કરતા અટકાવે છે અને ઈન્સાનને દરેક ભલાઈ અને લાભદાયક ચીજોથી દૂર રાખે છે. અને વધુ પડતું પ્રવાહી પીવું

ઈન્સાનને બેવકૂફ, અજ્ઞાન અને બદસૂરત બનાવી દે છે તેમજ શરાફતથી દૂર રાખે છે.

૮. ગુપ્તઅંગો (શર્મગાહ)નો હક

અને તમારા ગુપ્ત અંગોનો એ હક છે કે તમે તેનું દરેક એ ચીજથી રક્ષણ કરો જે તમારા માટે હરામ છે. અને આ ધ્યેયની પ્રાપ્તિ માટે તમારી આંખોને નીચી રાખીને તમારી પોતાની મદદ કરો (કારણ કે બેશક તે શ્રેષ્ઠ મદદગાર છે) અને મૌતને વારંવાર યાદ કરીને અને તમારી જાતને અલ્લાહ અને તેના અજાબની ચેતવણી આપીને (પોતાની મદદ કરો). અને રક્ષણ અને સહાય અલ્લાહ પાસેથી જ માંગો, કારણ કે તેના સિવાય કોઈ તાકત કે શક્તિ નથી.

વિભાગ (સી): કાર્યનો હક

૧૦. નમાઝનો હક

નમાઝનો હક એ છે કે, તમારે તેને અહ્લાહ સાથેની મુલાકાત જાણવી જોઈએ, અને (વિચારવું જોઈએ કે) નમાઝ દરમ્યાન તમે અહ્લાહ સમક્ષ ઉભા છો. જો તમે આ (ઉપરોક્ત) વાસ્તવિકતાને અનુભવશો, તો તમે તેની બારગાહમાં એવા વિનન્દું બંદાની જેમ ઉભા રહેશો કે જે પોતાના ગુનાહના કારણે કાંપતો—ખૌફઝંદા હશે અને પોતાના મૌલાની મહેરબાનીની આશા રાખતો હશે. અને તમે તેના દરબારમાં હાજરી આપવાના કાર્યને મહાન જાણો. તમારી ભૂલો અને ગુનાહોએ તમને ધેરી લીધા છે, માટે શાંતિ અને વિનન્દતા સાથે આ બંધનથી છુટકારો માંગજો. અહ્લાહ સિવાય કોઈ તાકત કે શક્તિ નથી.

૧૧. રોજાનો હક

રોજાનો એ હક છે કે, તમે જાણી લ્યો કે (રોજા વડે તમે) પોતાને જહન્નમની આગથી બચાવવા માટે તમારી જબાન, કાન, આંખ અને પેટ ઉપર પર્દો મૂકો છો. હદ્દીસમાં વર્ણન છે કે, ‘રોજો જહન્નમની આગ સામે ઢાલ છે’ તેથી જો તમે તમારા શરીરના અવયવોને આ પર્દભિંના શાંત અને સ્થિર રાખશો, તો તમે તે ઢાલની અંદર તેમના સુરક્ષિત રહેવાની અપેક્ષા રાખી શકો છો. પરંતુ જો તમે આ આવરણ (પર્દા)ના ખૂણાઓને ઉચ્ચા કરવાનો પ્રયત્ન કરીને તેમને (અવયવોને) પર્દની પાછળ અશાંત રહેવાની છૂટ આપશો, તો તેઓ ત્રાંસી નજરે (આડકતરી રીતે) એ બાબતોને અનુભવશે જે તેમના માટે જાએઝ (છૂટ) નથી, અને તે કારણ બનશે એ વાસના અને ઈચ્છાશક્તિનું જે ખુદાના ખૌફ (તકવા)ની સરહદોની

બહાર છે, પછી તે (અવયવો) પદનિ ફાડી નહિં કાઢે અને બહાર નહિં નીકળી જાય એ બાબતે તમે ખાતરી નહિં રાખી શકો. અલ્લાહ સિવાય કોઈ તાકત કે શક્તિ નથી.

૧૨. હજનો હક

હજનો હક એ છે કે, તમારે સમજવું જોઈએ કે તે અલ્લાહ સમક્ષ આવી પહોંચવું છે અને એ જગ્યા છે જ્યાં તમારા ગુનાહો દૂર થઈ જશે, અગર તમારી તૌબા કબૂલ થશે. અને અલ્લાહે તમારી પર વાળું કરેલી ફરજને પણ તમે અદા કરો છો.

૧૩. સદકાનો હક

સદકાનો હક એ છે કે તમારે એ જાણવું જોઈએ કે, તે તમારા રબની પાસે તમારી બચત છે અને એવી

જમા થયેલી ચીજ છે જેના માટે કોઈ ગવાહની જરૂર નથી.

જ્યારે તમે આ (ઉપરોક્ત) બાબતની તરફ ધ્યાન આપશો, તો તમને ગુપ્ત બચત (ધૃપી રીતે દેવામાં આવતા સદકા)માં જાહેરી બચત કરતા વધારે ઈતિહાસનાન થશે.

માટે તમારા ઉપર જરૂરી છે કે જે ચીજ તમે ગુપ્ત રીતે અલ્લાહ પાસે અમાનત રૂપે રાખી છે તેની ખબર બીજાને ન આપો, (એટલે સુધી કે) આંખ-કાન વગેરેને પણ ગવાહ બનાવવાની કોશિશ ન કરો. આ અમાનત ગવાહ વગર પણ ભરોસાપાત્ર છે, માટે એવું ન વિચારવું કે ગવાહ વગર આ અમાનત તમને પાછી નહિં ભણે.

વધુમાં, તમારે કોઈને (સદકો આપીને) આભારી પણ ન બનાવવા, કારણ કે આ સદકો તો તમારા જ લાભ માટે છે. તેથી જો તમે તેને પોતાના

આભારી બનાવશો, તો તમે પોતાને જ અપમાનિત કરેલ ગણાશો. તમારું આ વર્તન પ્રદર્શન કરશો કે, તમે સદકાને તમારા લાભ માટે જમા નથી કરાવ્યો, કારણ કે જો તમારો ઈરાદો (નિખાલસ) હોત, તો તમે બીજા પાસેથી આભાર (શુક્રિયા)ની માંગણી ન કરી હોત. અલ્લાહ સિવાય કઈ શક્તિ કે તાકત નથી.

૧૪. કુરબાનીના જાનવરનો હક

કુરબાનીના જાનવરનો હક એ છે કે તેને ફકત તારા પરવરદીગાર માટેની જ ખાલિસ (શુધ્ય) નિયતથી, તેની રહેમત અને કબૂલીયતને નજરમાં રાખીને, ઝબુ કરવો જોઈએ, નહિં કે જોનારા લોકોની નજરો માટે. જ્યારે તમે આ ધારા—ધોરણ મુજબ અમલ કરશો, તો તમારા માટે કોઈ મુશ્કેલી નહિં હોય

અને બીજાઓ માટે પણ જોઈ અગવડતા નહિં થાય,
કારણ કે તમારો મકસદ ફક્ત અલ્લાહની ખુશી હશે.

તમારે જાણવું જોઈએ કે અલ્લાહ તે એજ ચાહે
છે જે તમારા માટે સુલભ (આસાન) હોય છે, નહિં કે
તે જે તમારા માટે મુશ્કેલ (અગવડતાભ્યું) હોય છે. તે
પોતાની મખ્લૂક માટે હુકમોને આસાન બનાવવા ચાહે
છે, અને તે તેમને મુશ્કેલીમાં મૂકવા નથી ચાહતો.
અને એ પણ કે અલ્લાહ તાત્ત્વાના દરબારમાં
વિનભ્રતા સાથે કુરબાની કરવી જોઈએ.

વિભાગ (ડી): ઉચ્ચ અને સર્વોપરી લોકોના હક

૧૫. રાજી / સત્તાધીશ / શાસકનો હક

તમારા સત્તાધીશનો એ હક છે કે, તમારે જાણવું
જોઈએ કે, અલ્લાહે તમારી ઉપર સત્તાના કારણે
તમને તેઓની કસોટીના માઘ્યમ બનાવ્યા છે. અને
તમારે ઈજલાસ સાથે તેને નસીહત કરવી જોઈએ અને

તેની વિરુદ્ધ બંડ (બળવો) ન કરવો જોઈએ, કારણ કે (બંડના કારણો) તમે તમારો પોતાનો જ વિનાશ નોતરશો.

તમે વિનઅતા સાથે તેની બક્ષિસને સ્વીકારો. તે તમારા દીનને નુકસાન નહિં પહોંચાડે, બલ્કે તમારા દીન માટે મદદરૂપ બનશે. તેની સત્તામાં બગાવત ન કરો, કારણ કે બગાવતથી દોસ્તીનો સબંધ કપાઈ જશે અને દુઃમની (અદાવત) પેદા થશે, જે તમારી હલાકતનું કારણ બનશે. આ રીતે તમે પોતાની જ વિરુદ્ધ વર્તન કરીને તેના સહાયક (મદદગાર) બનશો તેમજ જે કાંઈ તે તમારી સાથે કરશો તેમાં તમે તેના ભાગીદાર બનશો. અલ્લાહ સિવાય કોઈ તાકત કે શક્તિ નથી.

(સત્તાધીશો બે પ્રકારના હોય છે: (૧) આદિલ (૨) ઝાલિમ. ઉપરોક્ત હદ્દીસમાં બયાન થયેલ હક આદિલ સત્તાધીશો માટે છે.)

૧૬. શિક્ષકનો હક

તમારા શિક્ષકનો હક એ છે કે, તમે તેને માન આપો, તેને સાંભળો અને નિષ્ઠાપૂર્વક હાજર રહો.

તમારે તેની હાજરીને મહાન ગણી તેનો આદર જળવવો જોઈએ, અને તેની તરફ ચહેરો કરીને, એકમળન (એકચિત્ત) બનીને, અને ખાલીસ (શુદ્ધ) દિલથી, નફસની ઈચ્છાઓ અને બીજા વિચારોથી દૂર રહીને, તેની વાત ધ્યાન દઈને સાંભળો.

અને તમારે જાણવું જોઈએ કે તે જે કાંઈ તમને શીખવે છે તેમાં તમે બીજા લોકો માટે તેના સંદેશાવાહક છો, માટે જે કાંઈ શીખ્યા છો તેને કોઈપણ પ્રકારની વધ—ઘટ વગર (બીજાને) શીખવવું જોઈએ. અલ્લાહ સિવાય કોઈ તાકત કે શક્તિ નથી..

૧૭. માલિકનો હક

તમારા માલિકનો હક તમારા સત્તાધીશ (શાસક) જેવો જ છે, સિવાય એ કે માલિક તમારી ઉપર સત્તાધીશથી વધારે સત્તા ઘરાવે છે. તમારે તેની દરેક નાની—મોટી વાત માનવી જોઈએ સિવાય કે તેની ઈતાઅત તમને અલ્લાહની ઈતાઅતથી વિરુદ્ધ લઈ જતી હોય અને તમને અલ્લાહ તથા તેની મખ્લૂક પ્રત્યેની તમારી ફરજો પરીપૂર્ણ કરતા અટકાવતી હોય. (એવા સંજોગોમાં તમારે તેનું અનુસરણ ન કરવું અને તે સિવાયની બાકીની જવાબદારીઓ અદા કરવી) પરંતુ તે (અલ્લાહે મુકર્રર કરેલ) જવાબદારીઓ (ફરજો) અદા કર્યા પછી તમારે તમારા માલિક પ્રત્યેની ફરજો અદા કરવી જોઈએ અને તેની સાથે વ્યસ્ત રહેવું જોઈએ. અને કોઈ તાકત કે કુચ્ચિત નથી સિવાય કે અલ્લાહ વડે.

વિભાગ (ઈ): આશ્રિતો અને નીચેના લોકોનો હક

૧૮. પ્રજા / જનતાનો હક

જેની ઉપર તમે શાસન કરો છો (સત્તા ઘરાવો છો) તેનો એ હક છે કે, તમારે યાદ રાખવું જોઈએ કે તેઓની નબળાઈ અને તમારી તાકતના કારણે તેઓ તમારા તાબે થયા છે, તેથી તે લોકો દ્યા, રક્ષણ અને ધીરજ માટે કેટલા સુયોગ છે જેમની નબળાઈ અને ગુલામ—દશાએ તેમના માટે તમારા તાબે થવાનું કામ કર્યું અને તેઓ ઉપર તમારા આદેશો લાદવાનું કામ કર્યું, તેથી તેઓ તમારી સમક્ષ કેટલા નિઃસહાય અને અશક્ત છે, (અને જો તમે તેમને મુશ્કેલીમાં મૂકો) તો તેઓ કોઈ સહાયક નહિં પામે સિવાય કે અલ્લાહ. તમારે તમારી પ્રજા ઉપર મહેરબાની રાખવી જોઈએ, તેઓની જાન—માલ અને આબરૂની હિફાજત કરવી જોઈએ, તેઓની મદદ કરવી જોઈએ, તેઓની

સુખ—સુવિધાનો ઘ્યાલ રાખવો જોઈએ અને જાણવું જોઈએ કે તમારી સત્તા અલ્લાહની મહેરબાનીને કારણે છે. માટે તમને આપેલી આ સત્તા અને શક્તિમાં તેના લુત્ફની કદર કરો. અને જે અલ્લાહનો આભાર માને છે, અલ્લાહ તેની નેઅમતો વધારી આપે છે. અને કોઈ તાકત અને કુષ્યત નથી સિવાય કે અલ્લાહ વડે.

૧૮. વિદ્યાર્થીનો હક

અને જ્ઞાનમાં તમારી ઉપર નિર્ભર લોકોનો એ હક છે કે, તમારે એ જાણવું જોઈએ કે અલ્લાહે તમને, જ્ઞાનની ભેટ અને હિકમત (ઉહાપણ)ના ખજાનાની ચાવી આપી છે. તમારે તેમને મહેરબાનીની સાથે અલ્લાહે આપેલ ઈલમ શીખવવું જોઈએ, સબ્ર અને સહનશક્તિની સાથે તેઓની હિદાયત અને નસીહતનું

કામ કરવું જોઈએ. આ રીતે અલ્લાહે આપેલ ઈલ્મનો સમાજની અજ્ઞાનતા અને નાદાની દૂર કરવા માટે ઉપયોગ કરવો જોઈએ, પરંતુ જો તમે ઈલ્મનો આ રીતે ઉપયોગ નહિં કરો, તો પછી તમે (અલ્લાહે તમને અતા કરેલ ઈલ્મની) ઉચાપત કરવા બદલ દોષિત (અપરાધી) બનશો, અને તેની મખ્લૂક પ્રત્યે ઝાલિમ બનશો.

૨૦. પત્નિનો હક

તમારી પત્નિનો એ હક છે કે, તમારે જાણવું જોઈએ કે, અલ્લાહે તેણીને તમારા માટે આરામ અને રાહત બનાવી છે, તેમજ તમારા માટે તે એક ભિત્ર (સાથી) અને (ગુનાહોની સામે) ઢાલ છે.

અને એજ પ્રમાણે, તમારા બંને માટે એ જરૂરી ફરજ છે કે, તમો તમારા સાથીદાર (પતિ કે પત્નિ)

માટે અલ્લાહનો આભાર માનો અને એ જાણો કે તે સાથીદાર (પતિ કે પતિની) એ તમારી ઉપર અલ્લાહનો લુત્ફ (ફરજિલ) છે.

અને અલ્લાહના આ ફરજિલ (પતિની)ની સાથે સારો સંગાથ (ભાગીદારી) જરૂરી છે. અને તેણીનું માન જાળવવું અને તેણી પ્રત્યે દયાભાવ રાખવો જરૂરી છે, ભલેને તમારા તેણી ઉપરના હકો અને અધિકારો વધુ મોટા છે તો પણ. પતિની માટે તમારી ઈતાઅત કરવી નિશ્ચિયત છે, સિવાય કે ગુનાહ અને અલ્લાહની નાફરમાનીના કાર્યો. આમ, તેણી મોહબ્બત અને સંગાથ અને જરૂરી ઈચ્છાપૂર્તિને કારણે હક ઘરાવે છે. આ હક અદા કરવાની જવાબદારી એક બહુ મોટી જવાબદારી છે. અલ્લાહ સિવાય કોઈ કુષ્યત કે તાકત નથી.

૨૧. ગુલામનો હક

અને ગુલામી ધ્વારા તમારી ઉપર આશ્રિતનો એ હક છે કે, તમારે એ વાસ્તવિકતા જાણવી જોઈએ કે તે તમારા રબની મખ્લૂક છે, અને તે તમારું પોતાનું જ માંસ (અંગ) અને લોહી છે. તમે તેના માલિક છો, પરંતુ ન તો તમે તેનું સર્જન કર્યું છે અને ન તો તમે તેના કાન કે આંખ બનાવ્યા છે અને ન તો તમે તેને રોઝી આપી છે. તે અલ્લાહ જ છે જેણે તેના માટે આ બધું અંજામ આપ્યું અને પછી તેને તમારો આશ્રિત (અવલંબિત) બનાવ્યો અને તેને તમારા ભરોસે સૌપણી કરી, જેથી કરીને તમે અલ્લાહની (આ) અમાનતની તેના વતી દેખરેખ રાખો, જેવી રીતે અલ્લાહ તેની મખ્લૂકની સાથે વર્તન કરે છે (જેમ કે, મોહષ્યત અને કાળજ). તેથી તમારે તેને એ ખવડાવવું જોઈએ જે તમે ખાવ છો અને તમારે તેને તે

લિબાસ પહેરાવવો જોઈએ જે તમે પહેરો છો, અને તેની પાસે એ (કામની) માંગણી ન કરવી જેને તે ન કરી શકતો હોય. અને જો તમને તે ગમતો ન હોય, તો પછી તમે તેની જવાબદારી (જે અલ્લાહે તમારી ઉપર મૂકી છે તે) માંથી પોતાને મુક્ત કરી દો, તેને જવા દો અથવા તેને બદલી નાખો. પણ, અલ્લાહની મખ્લૂકને (હરગિઝ) સત્તાવશો નહીં (સજા આપશો નહિં) અને અલ્લાહ સિવાય કોઈ કુષ્ટત કે તાકત નથી..

વિભાગ (એફ): સગા—સંબંધીઓનો હક

૨૨. માતાનો હક

અને તારી ‘મા’નો એ હક છે કે, તારે એ કદર કરવી જોઈએ કે, તેણીએ એવી રીતે તારો ભાર ઉંચક્યો છે કે એવી રીતે કોઈ વ્યક્તિ બીજાનો ભાર નથી ઉંચકતી. અને તેણીએ પોતાની છાતીના ફળો વડે તને ખવડાવ્યું, જે કોઈ બીજાને નથી ખવડાવતું. અને

તેણીએ (સગભર્વિસ્થામાં) પોતાના કાન અને આંખ, હાથ અને પગ, વાળ અને ચામડી તથા બીજા દરેક અંગો વડે તારું રક્ષણ કર્યું. તેણીએ આ બધું ખૂબ જ ખુશીથી, આનંદિત બનીને અને કાળજીપૂર્વક કર્યું. તેણીએ (સગભર્વિસ્થાની) આપત્તિઓ, વેદના, તકલીફો અને દુઃખને ધીરજપૂર્વક સહન કર્યા. ત્યાં સુધી કે શક્તિશાળી અલ્લાહે તને તેણી(ના ગર્ભ)માંથી બહાર કાઢી આ દુનિયામાં લાવી દીધો. પછી તેણી ભૂખી રહીને પણ તને ખવરાવવામાં ખુશ થતી અને પોતાની પાસે કપું ન હોય તો પણ તને કપડાં પહેરાવતી હતી, પોતાની ઘાસની પરવા ન કરીને તને દૂધ અને પાણી આપતી હતી. પોતે ગરમી અને તડકો સહન કરીને તને છાયામાં રાખતી હતી. પોતે તમામ સખ્તીઓ વેઠી તને તમામ આસાનીઓ આપતી હતી. પોતે જાગીને તને સુવરાવવા માટે શાંત પાડતી હતી. અને (યાદ કર કે) તેનું ગર્ભ તારું રહેઠાણ હતું,

અને તેનો ખોળો તારું આશ્રયસ્થાન હતું અને તેની છાતી તારા માટે ખોરાકની વ્યવસ્થા હતી, અને તેણીનું સમગ્ર અસ્તિત્વ તારું રક્ષણ હતું. એ ‘મા’ જ હતી જેણે તારી સુખ—સરગવડતા માટે ગરમી અને ઠંડીનો સામનો કર્યો.

તેથી તારે તેના આભારી રહેવું જ જોઈએ, અને તું તેમ કરી શકીશ નહિં, સિવાય કે અલ્લાહની મદ્દ અને તૌફીક વડે.

૨૩. પિતાનો હક

અને તારા પિતાનો એ હક છે કે તારે એ વાસ્તવિકતા જાણવી જોઈએ કે, તે તારું મૂળ છે અને તું તેની શાખા છો. અને તેની વગર તારું અસ્તિત્વ જ ન હોત. તેથી જ્યારે પણ તને તારામાં એવું કાંઈ દેખાય, જે તને આનંદ પહોંચાડે, તો યાદ કર કે તારા પિતા તે

નેઅમતના મૂળ માધ્યમ છે. અને તારા પિતાજીની નેઅમત પ્રમાણે અહ્લાહનો આત્મારી બની જી. કોઈ તાકત કે શક્તિ નથી અહ્લાહ સિવાય.

૨૪. સંતાનનો હક

અને તારા પુત્રનો એ હક છે કે તારે જાણવું જોઈએ કે, તે તારામાંથી છે, અને તે પોતાના તમામ સારા અને ખરાબ ગુણો વડે આ હુનિયામાં તારી સાથે જોડાયેલો છે, અને એ કે તું જવાબદાર છો તેને સારી રીતભાત અંગે સૂચના આપવા માટે, અને તેના રબની તરફ માર્ગદર્શન આપવા માટે, અને તેના (રબના) આદેશોના અમલીકરણમાં મદદ કરવા માટે જે તારી કે તેની સાથે સંબંધિત છે. અને તને આ જવાબદારીનો સારો બદલો (જગ્ઝા) કે સજી આપવામાં આવશે (આ માર્ગદર્શનની સફળતા કે નિષ્ફળતા પ્રમાણે)

તેથી, તારે તેની તાલીમ બાબતે એ વ્યક્તિત્વી જેમ જહેમત ઉઠાવવી જોઈએ કે જેને આ જગતમાં (પોતાના બાળકની અસરો / આદતો વડે) શાશ્વતરવામાં આવી રહ્યો હોય. બાળક સાથેનો બ્યવહાર સારો રાખ, જેથી તું અલ્લાહ તાલાદાએ સોચેલી સરપરસ્તીની જવાબદારીને સારી રીતે અદા કરી શકીશ.

૨૫. ભાઈનો હક

અને તારા ભાઈનો એ હક છે કે તારે જાણવું જોઈએ કે, તે તારો હાથ છે, તારો આધાર (ટેકો) છે, અને તારી તાકત છે, જેના વડે તુ હુમલો કરો છો. તેથી તેને અલ્લાહની નાફરમાની કરવા માટેનું સાધન ન બનાવ, અને ન તો ગુલ્ઘ કરવા માટે અને અલ્લાહના હકોનું ઉલ્લંઘન કરવા માટે તેને માધ્યમ

બનાવ. તેના નફસની અયોગ્ય ઈચ્છા વિરુદ્ધ અને તેના દુશ્મન વિરુદ્ધ તેની મદદ કરવાનું ચૂકતો નહિં. પછી જો તે અલ્લાહની ઈતાઅત કરે અને તેની પુકારનો યોગ્ય જવાબ આપે, (તો તે બધા માટે સારું છે), નહિંતર પછી તારા ભાઈનો પક્ષ લેવાને બદલે તારી પસંદગી અને તારા આદરભાવનો હેતુ અલ્લાહ જ હોવો જોઈએ. (એ વખતે કે જ્યારે તારો ભાઈ તારી નસીહતો અને ચેતવણી છતાપણ શરીઅતનું ઉલ્લંઘન કરે ત્યારે) તું અલ્લાહની ખુશીને અગ્રતા આપ એ તારા માટે વધુ ઈચ્છનીય છે.

૨૬. આજાદ કરનાર માલિકનો હક

અને તારા ભૂતપૂર્વ માલિકનો હક છે, જેણે તને મુક્ત કર્યો એ રીતે કે તેણે પોતાના માલને તારા માટે ખર્ચ કર્યો અને પછી તે તને ગુલામીના અપમાન અને

તેની પીડામાંથી બહાર કાઢી આજાઈ(મુક્તિ)ના સ્વમાન અને ખુશી તરફ લઈ આવ્યો. અને તેણે તને ગુલામીના બંધનમાંથી મુક્ત કર્યો, અને તેણે ગુલામીની બેડીઓને તારાથી દૂર કરી દીધી અને તેણે તારા માટે આત્મ—સન્માનની ખુશુને પ્રાપ્ત બનાવી. અને તે તને અત્યાચારની કૈદમાંથી બહાર લઈ આવ્યો. અને તેણે સખ્તીઓને તારાથી દૂર રાખી. અને તેણે તારા લાભ માટે પોતાની ન્યાયની જબાનને ખોલી દીધી. અને તેણે તારા માટે આખી દુનિયાને ખુલ્લી કરી દીધી. અને તેણે તને તારો પોતાનો જ માલિક બનાવી દીધો. અને તેણે તારી બેડીઓને / બંધનોને ખોલી નાખ્યા. અને તેણે તને એકમાત્ર અલ્લાહની ઈબાદત અને ઈતાઅત કરવાનો મૌકો આવ્યો. અને તને મુક્ત કરીને તેણે પોતાના માલમાં નુકસાન વેઠયું. તેથી તારે એ જાણી લેવું જોઈએ કે તારા સગા—સંબંધીઓ પછી અન્ય કોઈપણ કરતા

વધારે તેના તારી ઉપર હકો રહેલા છે. બંનેમાં, જંદગીમાં અને મૌત સમયે. અને તે એ વ્યક્તિ છે જે સૌથી વધારે તારી ભદ્ર, સહાય અને ટેકાને પાત્ર છે. તેથી અગાર જો તેને તારી પાસેથી કંઈક જરૂર હોય, તો એવા સમયે તું તારી પોતાની ઉપર તેને અગ્રતા આપી દેજો.

૨૭. આગાદ કરવામાં આવેલ ગુલામ(નોકર)નો હક

અને તારા ભૂતપૂર્વ ગુલામ (નોકર)નો એ હક છે કે, જેને તે આગાદ કરી દીધો એ જાણીને કે અલ્લાહે તને તેનો રક્ષક, સહાયકર્તા, આશ્રય આપનાર, ભદ્રગાર અને રક્ષણ કરનાર નિયુક્ત કર્યો છે, અને અલ્લાહે તને માધ્યમ બનાવ્યો છે તારી અને પોતાની વચ્ચે.

તેથી, આ આગાદ કરી દેવું અલ્લાહે તરફથી આખેરતમાં એક અજ્ર (બહુ મોટા વળતર)ને લઈ

આવશે, અને આ દુનિયામાં (પણ). અને અગર તેના કોઈ કુટુંબીજનો નથી, તો અલ્લાહે તને તેનો વારસો આખ્યો છે. જો તેનો કોઈ કુટુંબી વારસદાર હશે, તો પછી અલ્લાહે તારા બીજી જગ્યાએથી તારા માલમાં વધારો કરશે. અલ્લાહે તરફથી (દુનિયામાં) તારા માટે આ ઈનામ નક્કી કરવામાં આવ્યું છે. અને કોઈ કુષ્યત નથી સિવાય કે અલ્લાહે વડે.

વિભાગ (જી): વ્યક્તિગત સંબંધો ઉપર આધારિત હક

૨૮. ભલાઈ કરનારનો હક

અને તારી સાથે ભલાઈ કરનારનો એ હક છે કે, તારે તેનો આભાર માનવો જોઈએ, અને તારે તેની નેકી અને ભલાઈને યાદ રાખવી જોઈએ અને તેની નેકીનો—ભલાઈનો પ્રચાર કરવો જોઈએ, અને ખરા દિલથી તેના માટે દોઆ કરવી જોઈએ. કારણ કે જો તું તેમ કરીશ, તો તે છુપી રીતે અને જાહેરમાં બંને રીતે

તેનો આભાર માન્યો ગણાશે. ત્યાર પછી, જો શક્ય
હોય તો તેને બદલો આપ તારા કાર્યો વડે તેની સાથે
નેકી કરીને, જો તેને કોઈ જરૂરત ન હોય તો તેનું ધ્યાન
રાખજે અને જ્યારે પણ જરૂર પડે તેની મદદ કરજે.

૨૯. અજાન આપનારનો હક

અને મોઅગ્રઝીન(અજાન આપનાર)નો એ હક
છે કે, યાદ રાખવું જોઈએ કે તે તને તારા રબની યાદ
અપાવે છે અને તે તને તારા ફાયદા તરફ બોલાવે છે.
અને અલ્લાહે તારી ઉપર વાળું કરેલી ફરજને અદા
કરવામાં તે તારો શ્રેષ્ઠ સહાયક છે. તેથી તારે આ કામ
માટે તેનો એવી રીતે આભાર માનવો જોઈએ, જેવી
રીત કે તું તારી સાથે ભલાઈ કરનારનો આભાર માનો
છો. અને જો તું તેના અમુક કાર્યો પ્રત્યે બદગુમાન હો,
તો પણ અજાન માટે તેના પ્રત્યે નેક ગુમાન રાખજે.

અને તારે જાણી લેવું જોઈએ કે તે ખરેખર તો અલ્લાહ તરફથી તારા માટે એક લુત્ફ (કૃપા) છે. તેથી તારે તેની સાથે ભલાઈથી વર્તવું જોઈએ અને સારી રીતભાતથી વર્તવું જોઈએ, દરેક પરિસ્થિતિમાં અલ્લાહની નેઅમત માટે તેનો આભારી બનીને રહેજે.

૩૦. નમાઝ પઢાવનાર (પેશઈમામ)નો હક

અને તારી રોજંદા નમાજો પઢાવનાર (પેશઈમામ)નો એ હક છે કે, તારે જાણી લેવું જોઈએ કે, તેણે તારા વતી અલ્લાહ સમક્ષ રજૂ થવા માટે અલ્લાહ અને તારા વચ્ચેના પ્રતિનીધી તરીકેની ભૂમિકા (જવાબદારી) લીધી છે. અને તે અલ્લાહ તઆલાની મહેમાનગતિમાં તારા વતી બોલે છે જ્યારે કે તું તેના વતી નથી બોલતો. અને તે તારા માટે દોઆ

કરે છે જ્યારે કે તું તેના માટે દોઆ નથી કરતો. અને તે તારા માટે ઈચ્છા કરે છે, તું તેના માટે ઈચ્છા નથી કરતો. અને તે અલ્લાહ સમક્ષ ઉભા રહેવાની બાબતે તારી કિફાલત (આગેવાની) કરે છે. જો તે નમાઝને સહી રીતે અદા ન કરે, તો તેના માટે તે જવાબદાર છે નહીં કે તુ. અને જો તે નમાઝ દરખાન ભૂલ કરે, તો તું તે ભૂલમાં શરીક ગણાઈશ નહીં. તારી ઉપર તેને કાંઈપણ સરસાઈ હાંસિલ નથી છતાં પણ આ રીતે તેણે પોતાના વડે તારું રક્ષણ કર્યું, અને તેણે પોતાની નમાઝ વડે તારી નમાઝને રક્ષણ આપ્યું. તેથી એ બદલ તું તેનો આભાર વ્યક્ત કર. અલ્લાહ સિવાય કોઈ શક્તિ કે તાકત નથી.

અ. સાથે બેસનારનો હક

અને તારી સાથે બેસનારનો એ હક છે કે, તું હસતા ચહેરા અને નમ્રતાની સાથે તેનું સ્વાગત કર. એવું ન થાય કે ફક્ત તું જ બોલ—બોલ કર, બલ્કે તેને પણ બોલવાનો મૌકો આપ. અને તું તેને હરગીઝ તુચ્છ (હલ્કી) નજરોથી ન જોઈશ. તારા શબ્દોને સહી ઉચ્ચારની સાથે બોલ, કે જેથી તું જે કાંઈ બોલો છો તેને તે સમજી શકે.

અને જો તું તેની પાસે જઈને બેસવામાં પહેલો હો, તો તું તારી ઈચ્છા મુજબ ઉભો થઈ શકો છો. પરંતુ જો તે પોતે આવીને તારી પાસે બેસે, તો તે પોતાની ઈચ્છા મુજબ ઉભો થઈને જઈ શકે છે પરંતુ તારે તેની રજા વગર ઉભા ન થઈ જવું જોઈએ. અલ્લાહ સિવાય કોઈ શક્તિ કે તાકત નથી..

ઉર. પાડોશીનો હક

અને તારા પાડોશીનો એ હક છે કે, જ્યારે તે હાજર ન હોય, તું તેના હિતોનું રક્ષણ કર, અને જ્યારે તે હાજર હોય, તો તેને માન આપ, અને બંને પરિસ્થિતિમાં તેની મદદ અને સહાય કર. તેની છુપાયેલી ખામીઓ તરફ નજર ન કર અને તેની ખામીઓ શોધવા માટે તેના વ્યવહારોની ખોદણી ન કર (ઉંડો ન ઉત્તર). પરંતુ જે અનાયાસે (આપમેળે) તને તેની કોઈ ખામી જોવા મળે, તો તું જે કાંઈ જાણો છો તને સુરક્ષિત કરવા માટે ભેટી ન શકાય તેવો કિલ્લો બની જા, અને મુસીબત વખતે તને એકલો છોડી ન ઢે અને તેની નેઅમતો બાબતે તેની ઈષ્ટ ન કર. તેની ખતાઓને નજરઅંદાજ કર અને તેની ભૂલોને માફ કરી ઢે. અને જ્યારે તે તારી સાથે અયોગ્ય વર્તન કરે, તો તું સબ્ર અને ધીરજને ભૂલી ન

જતો અને તેની સાથે શાંતિથી વર્તણૂક કર. અને બીજા કોઈને તેના વિષે ખરાબ બોલવા ન હે, અને અગર કોઈ તેનું બુરું બોલે, તો તેની વાત પર યકીન ન કરજે. અને તેની સાથે એક મોહક (વિવેકી) જીવન પસાર કર. અહ્લાહ સિવાય કોઈ શક્તિ કે તાકત નથી.

ઉત્ત. મિત્રનો હક

અને તારા મિત્રનો એ હક છે કે, જો તું ઈલ્મ અને કમાલમાં તેનાથી આગળ હોય, તો એવી રીતે વાત—ચીત કર કે તે તારાથી કાંઈક શીખીને ફાયદો હાંસિલ કરે, જો તે ઈલ્મ અને કમાલમાં તારા કરતા આગળ હોય તો તેને બોલવા હે, કે જેથી તું તેની પાસેથી કાંઈક શીખીને ફાયદો હાંસિલ કરી શકે. અને તારે તેનું એવી જ રીતે માન જાળવવું જોઈએ, કે જેવી રીતે તું ઈચ્છો છો કે તે તારું માન જાળવે, તેની મદદ

કરવા માટે હંમેશા આગળ રહે, પરંતુ જો તે તારાથી આગળ વધી જાય, તો તું તેને (મહેરબાનીથી) બદલો આપ અને તારી મોહબ્બતમાં કમી ન કર જેના માટે તે લાયક છે. તેના પ્રત્યે ખરા દિલથી તેની ભલાઈ ચાહ, ભલાઓ અને મુસીબતોના સમયમાં તેનું રક્ષણ કર, અલ્લાહની ઈતાઅતમાં તેની મદદ કરવાનો અને તેના વ્યક્તિગત કામો જે તેના પાલનહારની વિરુદ્ધ ન હોય તેમાં તેની સહાય કર, જો તે ગુનાહ કરવાનો નિર્ણય કરી લે, તો તેને ગુનાહ કરવાથી અટકાવી લે. અને છેલ્લે એ કે તારે તેના માટે મહેરબાની અને દયા બનવું જોઈએ, નહિં કે યાતના અને પીડા.

વિભાગ (એચ): આર્થિક, કાયદાકીય અને સામાજિક

સંબંધો ઉપર આધારિત હક

૩૪. ભાગીદાર(પાર્ટનર)નો હક

અને તારા ભાગીદારનો એ હક છે કે, તું તેની ગેરહાજરીમાં તેના બોજને ઉપાડી લે. અને જ્યારે તે હાજર હોય, તો તું તેની સાથે એકસરખું કામ કર. અને તેના અભિગ્રાય / મતને ધ્યાનમાં લીધા વિના કોઈપણ નિષ્ણય ન કર. અને તારા વિચાર / અભિગ્રાયને તેની સલાહ લીધા વિના લાદી ન દે. (અમલમાં ન મૂકી દે) અને તેની સંપત્તિનું તેના માટે રક્ષણ કર. અને તેની ઉચાપત / છેતરપીડી કરવાથી દૂર રહેજે, ભલેને પછી તે વધુ ગ્રમાણમાં હોય કે ઓછા, કારણ કે આપણને (હદ્દીસમાં) કહેવામાં આવ્યું છે કે, ‘અલ્લાહનો હાથ ત્યાં સુધી એ ભાગીદારો

ઉપર હોય છે, જ્યાં સુધી તેઓ (એકબીજાને) છેતરતા નથી.' અને કોઈ કુવ્વત નથી સિવાય કે અલ્લાહ વડે.

ઉપ. માલ—દૌલતનો હક

અને તારા માલ(સંપત્તિ)નો એ હક છે કે, તારે તેને હલાલ માધ્યમો સિવાય ન ભેળવવો જોઈએ, અને તેને હલાલ કામો માટે જ વાપરવો જોઈએ, તેના થકી દુનિયા અને આખેરતનો ફાયદો હાંસિલ થઈ શકે એ રીતે તેનો ઉપયોગ કરવો જોઈએ. તમામ માલ—દૌલત અને સંપત્તિ અલ્લાહ તરફથી જ છે, તેથી તેને અલ્લાહ સુધી પહોંચવા સિવાય બીજા કામ માટે ઉપયોગમાં ન લઈશ, અને તેને અલ્લાહ સુધી પહોંચવાનો માર્ગ બનાવી લે.

એવું ન થાય કે તું તારા માલને તારી જાત કરતા પણ વધારે કિંમતી સમજી લે, અને શારીરીક અને

તુછાની પ્રગતિના કાર્યમાં ખર્ચ કરવાથી અટકી જા.
તારો માલ એવા લોકો માટે ન મૂકી જા, જેને તારી
ચિંતા ન હોય. જો તેઓ આ માલને ગુનાહમાં ખર્ચ
કરશે, તો તેના ગુનાહમાં તું ભાગીદાર બનીશ અને જો
તેઓ માલને અલ્લાહની ઈતાઅતમાં ખર્ચ કરશે, તો
તેનો ફાયદો તેઓને જ મળશે. (જો તે આ માલ
અયોગ્ય રીતે સંગ્રહ કર્યો હશે તો) ગુનાહનો બોજ,
પસ્તાવો અને આખેરતની સજા તારા ભાગે આવશે.
અલ્લાહ સિવાય કોઈ શક્તિ કે તાકત નથી..

(તારા માટે બહેતર છે કે તેને એવા વારસદારો
માટે ન છોડી જા, જે તેનો ઉપયોગ અલ્લાહની
નાફરમાનીમાં કરે અને તારો માલ એ ગુનાહોના
કામમાં તેના માટે સહાયરૂપ બને. અને અગર જો તું
તારા માલને એવા માટે છોડી જઈશ, જે તેનો ઉપયોગ
અલ્લાહની ઈતાઅતમાં તારી કરતા વધુ સારી રીતે
કરે, તો પછી તે તારાથી વધારે ફાયદો મેળવી જશે.)

ડેસ્ક કર્જ આપનારનો હક

અને તને કર્જ (લોન) આપનાર કે જે તારી પાસે
લોન પરત માંગે છે તેનો એ હક છે કે, જો તું તે કર્જ
ચૂકવી શકે તેમ હોય, (તારી પાસે પૂરતા પૈસા હોય)
તો તારે તેને (કર્જની) સંપૂર્ણ ભરપાઈ કરી આપવી જ
જોઈએ. અને તારે (કર્જની ચૂકવણીમાં) ઢીલ ન
કરવી, કારણ કે અલ્લાહના રસૂલ(સ.)એ ફરમાવ્યું
છે: ‘કર્જ ચૂકવવામાં વિલંબ કરવો જુલ્દું છે’

અને જો તું સખત સમયનો (આર્થિક ભીસનો)
સામનો કરી રહ્યો છે, તો પછી તારે તેને પ્રેમાળ
વાતોથી ખુશ કરવો જોઈએ અને તેને નાન વિનંતી
કરવી જોઈએ કે તે કર્જની મુદ્દાટ લંબાવી આપવા
મંજૂરી આપે, અને તું તેને માલના નુકસાન ઉપરાંત
ખરાબ વ્યવહારોથી યાતના આપીશ નહિં, કારણ કે તે

હલ્કીવૃતિ છે. અલ્લાહ સિવાય કોઈ શક્તિ કે તાકત નથી.

૩૭. સહકાર્યકરનો હક

તારી જવાબદારી છે કે તું તારા સહકાર્યકર (સ્ટાફમાં સાથે કામ કરતી વ્યક્તિ)ની સાથે છેતરપીડી કે પ્રપંચ ન કર, અને તારે તેની વાતને ખોટી ન ઠેરવવી જોઈએ, કે ન તો તેની સાથે દગ્ગો કરવો જોઈએ. અને તારે તેની સાથે દુશમનની જેમ ન વર્તવું જોઈએ. અને જો તે તારી ઉપર વિશ્વાસ કરે, તો તેના ફાયદાને તારા ફાયદા ઉપર અગ્રતા આપજે, અને જાણી લે કે વિશ્વાસનો ભંગ કરવો એ વ્યાજ (સમાન ગુનાહ) છે.

૩૮. દાવો કરનાર(વાઈ)નો હક

દાવો કરનાર(વાઈ)નો એ હક છે કે, જો તેનો તારી વિરુદ્ધનો દાવો સાચો છે, તો તેની દલીલને તોડવાનો પ્રયત્ન ન કરીશ કારણ કે તારું એમ કરવું એ તારા દિલની અવાજનો વિરોધ થશે, બલ્કે ખુદ તારો જ વિરોધ થશે, કારણ કે તું જાણો છે કે સામા પક્ષવાળાની વાત સાચી છે, માટે તારે તારી પોતાની જ વિરુદ્ધ ન્યાય કરનાર બની જવું જોઈએ. અને બીજા કોઈ ગવાહની જરૂરત વિના તેના દાવા માટે તારે પોતે જ ગવાહ બની જવું જોઈએ, કારણ કે આ એ ફરજ છે જેને અલ્લાહે તારી ઉપર મુકર્રર કરી છે.

અને જો તેનો દાવો ખોટો છે, તો તેની સાથે નઅતાથી બ્યવહાર કર અને તેના દિલમાં ખૌઝે ખુદા નાખ અને તેને તેના ધર્મ મારફતે ભૌત, કયામત અને અગ્રાબની યાદ અપાવીને તેને મંદ પાડી હે. અને

અદબ અને અખ્લાક વિરુદ્ધની વાતોથી પરહેજ કરજે, કારણ કે આ પ્રકારની વાતો તારો દુશ્મનની દુશ્મનીને બહાર નહિં હટાવી શકે, તારો દુશ્મન આ પ્રકારની વાતોને કારણે પોતાની દુશ્મનાવટની તલવારને તારી વિરુદ્ધ તેજ કરશે, કારણ કે ખરાબ શબ્દો બુરાઈને ઉત્તેજન આપે છે અને સારા (શબ્દો) બુરાઈને કાપી નાખે છે. અખ્લાષ સિવાય કોઈ શક્તિ કે તાકત નથી.

૩૮. જેની ઉપર દાવો માંડવામાં આવ્યો છે તે (પ્રતિવાદી)નો હક

જેની વિરુદ્ધ તે દાવો (કેસ) દાખલ કર્યો છે, તેનો એ હક છે કે અગર તારો દાવો સાચો છે, તો તે દાવાનું વર્ણન કરતી વખતે તેની સાથે નભ્રતાથી વાત કર, કારણ કે દાવાનો અવાજ પોતે જ પ્રમાણમાં પૂરતો કરક (કર્કશ અને અણગમતો) હોય છે. (માટે તું તારી ભાષાની કડકાઈનો તેમાં ઉમેરો ન કર), અને તારી

દલીલોને નભ્રતાપૂર્વક સમજાવ; તારી વાતનું સ્પષ્ટ રીતે વર્ણન કર, અને જો વિચારવા માટે સમયની જરૂર હોય તો મોહલત આપ.

૪૦. સલાહ માંગનારનો હક

તારી પાસે સલાહ માંગનારનો એ હક છે કે, જો તારી પાસે તેના માટે ફાયદાકારક સલાહ હોય, તો તેને એવી સલાહ આપ કે જે એવી હોય કે, અગર તું તેના સ્થાને હોત, તો તે એજ સલાહનું અનુસરણ કર્યું હોત. અને તે સલાહ વિવેકપૂર્વક અને નરમાશથી રજૂ થવી જોઈએ, કારણ કે નરમાશ અજાણ્યા માણસોને પણ ભિત્રોમાં ફેરવી નાખે છે, જ્યારે કે કડકાઈ ભિત્રોને પણ અજાણ્યા બનાવી દે છે.

અને જો તારી પાસે તેના માટે કોઈ સારી સલાહ ન હોય, તો તારે તેને એ વ્યક્તિત્વની સલાહ લેવા

જાણાવવું જેને તું જાણતો હોય અને જેની સલાહ પર તને ભરોસો હોય, અને જો તારી સાથે એવા પ્રસંગો ઉપસ્થિત થાય, તો તું તે વ્યક્તિના સલાહ—સૂચનો મેળવીને અમલ કરવા તૈયાર થઈ જા. તારે સલાહ માંગનારને તે વ્યક્તિની તરફ દોરી લઈ જવો અને માર્ગદર્શન અપાવવું. આ રીતે તે સલાહ માંગનારના હકમાં કચાશ રાખી નહિં ગણાય. અલ્લાહ સિવાય કોઈ શક્તિ કે તાકત નથી.

૪૧. સલાહ આપનારનો હક

અને તારા સલાહકારનો એ હક છે કે, અગર તેની સલાહ તારા મંતવ્યો અને વિચારો મુજબની નથી, તો તારે તેની પ્રમાણિકતા અને ખુલુસતા ઉપર શંકા ન કરવી, કારણ કે આ એક અભિપ્રાયની બાબત છે અને તે એક સ્વાભાવિક બાબત છે કે લોકોના

અભિપ્રાયો જુદા—જુદા હોય છે અને લોકો પાસે જુદા—જુદા દ્રષ્ટિકોણ હોય છે. તેથી અગાર જો તું તેની સાથે અસહમત છો, તો તું તારા મત અને અભિપ્રાય મુજબ ચાલવા માટે સ્વતંત્ર છો, પરંતુ તારા માટે એ ધોળ્ય નથી કે તું તારા સલાહકારને શંકા હેઠળ મૂકી હે. તું તેની સલાહને અધોળ્ય ગણી શકો છો, પરંતુ સલાહકારને નહિં, કારણ કે તે તેને સલાહ લેવા માટે ધોળ્ય ગણ્યો હતો, એટલે જ તો તે તેની પાસે સલાહ લીધી હતી..

અને જો તે તેની સલાહને કબૂલ કરી અને તારા મકસદને હાંસિલ કરી લીધો, તો અલ્લાહનો આભાર માન અને સલાહ આપનારનો પણ આભાર માન.

અને અગાર જો તેને ક્યારેક તારી સલાહની જરૂર હોય, તો ખયાનત વગર નિખાલસ અને પ્રામાણિક બનીને તેને સલાહ આપવી કે જેવી રીતે

તેણે તને આપી હતી.. અલ્લાહ સિવાય કોઈ શક્તિ કે તાકત નથી.

૪૨. નસીહત (ઉપદેશ) માંગનારનો હક

અને તારી પાસે નસીહત માંગનારનો એ હક છે કે, તારે તેની જરૂરત અને ક્ષમતા મુજબ તેને નસીહત કરવી જોઈએ, અને એ રીતે કરવી જોઈએ કે જે સાંભળવામાં અનુકૂળ (સુસંગત) લાગે (જેમ કે, મીઠી ભાષામાં) તેમજ તેના માટે તે નસીહત ઉપર અમલ કરવો શક્ય હોય. અને તારે તેની બુધ્યક્ષમતા મુજબ તેની સાથે વાત કરવી, કારણ કે દરેક અક્કલ (બુધ્ય) એ વાણીને ઓળખે છે અને સ્વીકારે છે જે તેના પોતાના લેવલ (સ્તર) મુજબની હોય, અને તારી પદ્ધતિ માયાળું હોવી જોઈએ. અલ્લાહ સિવાય કોઈ શક્તિ કે તાકત નથી..

૪૩. નસીહત (ઉપદેશ) આપનારનો હક

અને તને નસીહત (શીખામણ અને બોધપાઠ)
આપનારનો એ હક છે કે, તારે તેની સાથે નરમાશની
સાથે (વિનભ્ર) રહેવું, અને તેની વાતમાં તારા દિલ્લને
પરોવી રાખવું અને તેની અવાજ તરફ તારા કાનોને
ખુલ્લા રાખવા, જેથી કરીને તું તેની વાતને સમજ
શકે.

ત્યાર પછી તેની નસીહત ઉપર ચિંતન—મનન
કર. અગર તે સાચી હોય, તો અલ્લાહનો આભાર
માનવો, નસીહત કરનારની નસીહતને સ્વીકારી
લેવી, અને તે બદલ તેને માન આપવું. અને જો તને
તેની નસીહત અયોગ્ય જણાતી હોય, તો તેની પ્રત્યે
દ્યા રાખવી અને તેની ઉપર આક્ષેપ ન મૂકવો. તેનો
મકસદ તો નસીહત કરવાનો જ હતો, પરંતુ તેણે તેમ
કરવામાં ભૂલ કરી હતી.

જોકે અગાર તને એ વાતની ખબર હોય કે તે તારી પ્રત્યે પ્રમાણિક (નિખાલસ) ન હતો, તો પછી બાબત અલગ છે. પરંતુ એ કિસ્સામાં, તારે તેને જરાપણ સાંભળવો ન જોઈએ.

૪૪. મોટાનો (વડીલનો) હક

વયમાં મોટાનો એ હક છે કે, તારે તેની ઉમરના કારણે તેનો આદર કરવો જ જોઈએ, અને જો તેનામાં કોઈ ઈસ્લામી સદ્ગુણ હોય, તો તારે તેના ઈસ્લામના કારણે તેને માન આપવું જોઈએ. તારે તેને અગ્રતા આપવી જોઈએ અને વાતચીતમાં તેની સામે દલીલ ન કરવી જોઈએ, અને ચાલતી વખતે તેની આગળ નીકળી ન જવું, અને માર્ગમાં તેની આગળ કદમ ન માંડવા. જો તે અમુક બાબતોમાં જાહીલ હોય, તો તે જહાલત પ્રત્યે તેનું ધ્યાન દોરી (તેને શરમાવીશ)

નહિં. અને અગર તે તને જાહિલ કહે, તો સહનશીલતાથી કામ લેજે અને તેને માન આપજે, કારણ કે તેની વય પ્રમાણે ઈસ્લામમાં આગળ હોવાના હક્કને લીધે માનનીય છે. અલ્લાહ સિવાય કોઈ શક્તિ કે તાકત નથી.

૪૫. નાની વયની વ્યક્તિત્વનો હક

અને તારાથી વયમાં નાનાનો એ હક છે કે, તમે તેની સાથે ભિત્રતાથી રહો, તેને યોગ્ય રીતે તાલીમ અને શિક્ષણ આપો, અને તેની ભૂલોને અણાદેખી કરો, તેની ખામીઓને છુપાવી દયો, તેની પ્રત્યે દયાળું બનો, અને તેની મદદ કરો, અને તેની નાની વયને કારણે થઈ ગયેલી ભૂલોને છુપાવી દો, કારણ કે આ (મોહબ્બત અને સહાનુભૂતિ) તેના માટે પસ્તાવાનું કારણ બનશે. તેની સાથે ઝડપો ન કરવો, કારણ કે

તેમ કરવું એ તેના વિકાસ અને પ્રગતિમાં અવરોધક બની જશે.

વિભાગ (આઈ): લોકોના હક

૪૬. માંગણી કરનારનો હક

અને તારી પાસે મદદ માંગનાર (સાઈલ)નો એ હક છે કે, જો તું તેની જરૂરીયાત પૂરી કરી શકવા સક્ષમ છો, તો તારે તેની મદદ કરવી જોઈએ અને તેની મુશ્કેલીઓ દૂર થઈ જાય તે માટે દુआ કરવી જોઈએ. અને તેની મદદ કર.

અને જો તને તેની પ્રમાણિકતા અને સર્વ્યાઈ બાબતે શંકા હોય, તો પછી સાવચેત થઈ જા, કંદાચ એવું બને કે તારી આ શંકા તારા માટે શૈતાનની જાળ હોય કે જે તને તારા હિસ્સા (સવાબ)થી દૂર રાખવા માંગતો હોય અને તે તારા અને તારા રબ પ્રત્યેની નજીદીકના અમલની વચ્ચે અવરોધરૂપ બનવા દૃઢુતો

હોય. આમછતાં, જો તે તેને મદદ ન કરવાનો નિષ્ણય કરી લીધો છે, તો તેને (શરમીદા કર્યા વિના) સારો જવાબ આપી (નરમાશ)થી પાછો ફેરવી દે.

અને જો તને તેના વિષેની તારા દિલની શંકાઓ ઉપર અંકુશ આવી જાય અને તું તેને જે કાંઈ યોગ્ય લાગે તે આપી દે, તો પછી ચોક્કસપણે તે ખરી દ્રઢતા છે.

૪૭. જેની પાસે માંગણી કરવામાં આવે તેનો હક

અને જેની પાસે તું મદદ માંગો છો તેનો એ હક છે કે, અગર તે કાંઈક આપે, તો તેનો તોહફો તેની સખાવતની કદરદાની કરીને આભારની સાથે સ્વીકારી લે. અને જો તે ન આપે, તો પછી તેના ન આપવાના કારણને સ્વીકારી લે અને તેના વિષે સારો વિચાર (નેક ગુમાન) કર.

અને યાદ રાખ કે અગર તે આપવાનો ઈન્કાર કરી છે, તો તે તેની પોતાની માલ-મિલ્કત છે જેનો તેણે આપવાનો ઈન્કાર કર્યો છે અને તેની પોતાની માલ-મિલ્કતમાંથી ન આપવા બાબતે તેની નિંદા ન કરી શકાય. અને અગર તેણે માલને ખોટી રીતે આપવાનો ઈન્કાર કર્યો છે, તો પછી તું જાણી લે કે, “બેશક ઈન્સાન ચોક્કસપણે ખૂબ જ નાઈન્સાફી અને નાશુક્રો છે.” (સૂરે ઈંગ્રેજીમ, ૧૪ : ૩૪)

૪૮. ખુશ કરનારનો હક

અને એ વ્યક્તિ જેના મારફતે અલ્લાહે તને ખુશ કર્યો છે, તેનો એ હક છે કે, અગર તેણે તને ઈરાદાપૂર્વક ખુશ કર્યો છે, તો તારે સૌપ્રથમ અલ્લાહનો આભાર માનવો જોઈએ, અને પછી તેની સદ્ગ્રાવના બદલ તેનો આભાર માનવો જોઈએ. અને

જ્યારે તને તક મળે ત્યારે તે સંદૂભાવનાનો બદલો ચૂકવવાનો પ્રયત્ન કરવો, બલ્કે તેથી પણ કંઈક વધુ કરવાનો, કારણ કે મહેરબાનીની પહેલ તેની હતી. અને તું તેને ખુશ કરવાની તક શોધતો રહે.

અને જો તે વ્યક્તિએ તને બિનઈરાદાપૂર્વક અને અજાણતાથી ખુશ કર્યો છે, તો તારે અલ્લાહનો આભાર માનવો જોઈએ અને તેના આભારી બનવું જોઈએ, અને જાણી લે કે આ સંદૂભાવના અલ્લાહ તરફથી છે જેને તેણે તારા માટે અનામત (સુરક્ષિત) રાખી હતી. આમછતાં, તારે તે વ્યક્તિને ચાહવી જોઈએ કારણ કે અલ્લાહ તરફથી ભલાઈ (મહેરબાની)ને તારા સુધી લઈ આવવા માટે તે માધ્યમ હતી, અને પછી સંદાય તેની ભલાઈ માટે દુઅા કરતો રહે, કારણ કે અલ્લાહની મહેરબાનીનો સ્ત્રોત પોતે પણ એક બરકતનું કારણ છે, જ્યાંપણ તે

હોય, ભલેને પછી તે (મહેરબાની) બિનઈરાદાપૂર્વક થઈ હોય.

૪૮. દુઃખ પહોંચાડનારનો હક

એ વ્યક્તિ જેણે તને શબ્દો કે કાર્યો વડે દુઃખ પહોંચાડ્યું છે અથવા તારા માટે મુશ્કેલીનું કારણ બન્યો છે, અગર તેણે તેમ જાણી જોઈને અને ઈરાદાપૂર્વક કર્યું છે, તો પછી માફી આપી દેવી તારા માટે વધારે યોગ્ય છે, કારણ કે માફી આપી દેવાથી ભવિષ્યમાં તે આ પ્રકારના કામોથી દૂર રહેશે. અને વધુમાં, આ દુનિયામાં તારી જેવા ઘણા લોકો છે. તેઓ સાથે ભલાઈ અને મહેરબાનીથી વ્યવહાર કરશે, અને અલ્લાહ ફરમાવે છે: ‘‘અને જે કોઈ (પોતાની ઉપર) ગુલ્ભ પછી પ્રતિકાર કરે, તો તેઓ એજ લોકો છે કે જેઓ ઉપર નિંદા-મળિભ્મતનો કોઈ માર્ગ નથી.

(નિંદા—માર્ગભૂતનો) માર્ગ તો ફક્ત તેઓ માટે છે કે જેઓ લોકો ઉપર ઝુલ્ભ કરે છે અને ખોટી રીતે (નાહક) જમીન ઉપર અત્યાચાર કરે છે, આ એજ લોકો છે કે જેઓ માટે પીડાદાયક અગાબ છે. અને ખરેખર જેઓ સબ્ર કરે અને માફ કરી હે, તો ખરેખર તે મહા—મૂલ્યવાન કાર્યોમાંથી છે.” (સૂરે શુરા, ૪૨: ૪૧ થી ૪૩)

અને ફરી શક્તિશાળી, મહાન અલ્લાહ ફરમાવે છે: “અને જો તમે સજી કરો, તો પણ એજ પ્રમાણમાં કરો કે જેટલા તમને સત્તાવવામાં આવ્યા હતા, અને જો તમે સબર કરો, તો ખરેખર સબ્ર કરનારાઓ માટે સૌથી શ્રેષ્ઠ છે.” (સૂરે નહ્લ, ૧૬ : ૧૨૬)

આ બધી બાબતો તેને લાગુ પડે છે કે જેણે તારી ઉપર ઈરાદાપૂર્વક (જાણી જોઈને) ઝુલ્ભ કર્યો છે. પરંતુ અગર જો તે ઈરાદાપૂર્વક ન હોય, તો પછી તારે હેતુપૂર્વક બદલો લઈને તેને સત્તાવવો ન જોઈએ,

નહિંતર પછી તેનો ભતલબ એ થશે કે તે એક બિનઈરાદપૂર્વકની (અજાણતા થયેલી) ભૂલનો બદલો ઈરાદપૂર્વકની સજા વડે લીધો. તેની સાથે ધીરજ રાખ અને શક્ય તેટલી મહેરબાનીથી તેની સાથે વર્તન કર. અહ્લાહ સિવાય કોઈ તાકત કે શક્તિ નથી.

૫૦. મુસલમાનોનો હક

અને તારી સાથે રહેતા મુસલમાનોનો એ હક છે કે, તેઓ પ્રત્યે તારા દિલમાં મેલ ન રાખ, તેઓમાંના બુરા લોકો સાથે વિનાગ (નરમાશવાળો) બની જા અને તેઓની મોહબ્બત મેળવીને તેઓની સુધારણા કર. અને જેઓ પોતાના ચારિત્રમાં સદ્ગુણી છે તેઓનો અથવા તો જેઓ તારી પ્રત્યે ઉદાર છે તેઓનો આભારી બની જા, કારણ કે તેઓના ચારિત્રની ભલમનસાઈ, તારા પ્રત્યેના કોઈ પ્રત્યક્ષ લાભ વિના,

પોતે પણ તારા માટે એક સંદુગુણ છે, કારણ કે આ રીતે તેઓએ તને ઈજાથી બચાવ્યો છે અને તારા રક્ષણનો પ્રયત્ન કર્યો છે, અને પોતાની મુશ્કેલીઓને તારાથી દૂર રાખી છે. તેથી, તેઓ બધા માટે દુઆ કર.

અને તેઓ બધા માટે તારી મદદને તૈયાર રાખ, અને બધા મુસલમાનો સાથે તેઓના યોગ્ય સ્થાન મુજબ વ્યવહાર કર.

(વડીલોને તારા પિતાની જગ્યાએ અને નાની વયનાને તારા બાળકના સ્થાને સમજ અને સમોવડીયાને તારા ભાઈના સ્થાને ગણી લે. તારી પાસે તેઓ માટે દયા હોવી જોઈએ, અને તેઓથી નુકસાનને દૂર કરવા જોઈએ. તારે તેઓ માટે એ પસંદ કરવું જોઈએ જે તું તારા પોતાના માટે પસંદ કરો છો, અને તારે તેઓ માટે એ પસંદ ન કરવું જોઈએ, જે તું તારા માટે પસંદ નથી કરતો.)

૫૧. બિનમુસ્લિમોનો હક

અને ઈસ્લામી દેશમાં રેહતા બિનમુસ્લીમો (એહલે જીમહ)નો એ હક છે કે, તારે તેની પાસેથી તે સ્વીકારી લેવું જોઈએ જે અલ્લાહે તેમની પાસેથી સ્વીકાર્ય છે, તેઓ અને ઈસ્લામી હુકૂમત વર્ચ્યે થયેલ કરારને વજાદાર રહેવું જોઈએ. તમારી દરખ્યાન થતા વ્યવહારોમાં તારા અને તેઓ ઉપર જુલ્દુમ દરખ્યાન અલ્લાહના રક્ષણ, અલ્લાહ અને તેના રસૂલ(સ.)ના અહુદની વજાદારીનો પરદો રાખ, કારણ કે આપણાને કહેવામાં આવ્યું છે કે, પવિત્ર પયગમ્બર(સ.)એ ફરમાવ્યું છે: ‘જે કોઈ રક્ષિત બિનમુસ્લીમની સાથે અન્યાય કરશો, તો હું (કયામતના દિવસે) તેનો દુશ્મન હોઈશ.’ તેથી અલ્લાહથી ડરો (અને તેઓની સાથે ન્યાયથી વર્તન કરો) અલ્લાહ સિવાય કોઈ શક્તિ કે તાકત નથી.

ટ્રૂક્સાર

આમ, આ પચાસ હકો તારી આજુ-બાજુ છે,
જેણે તને ચારે તરફથી ધેરી લીધેલ છે અને તું તેનાથી
કોઈપણ પરિસ્થિતિમાં છટકી નથી શકતો. તારા માટે
(જરૂરી) ફરજ છે કે તું તેનું પાલન કર અને તું તે
હકોને અદા કરવાનો પ્રયત્ન કર અને (તે માટે)
અલ્લાહની મદદની માંગણી કર, ખૂબ જ વખાણ છે
તેના આ બધા માટે, અને કોઈ શક્તિ કે કુષ્યત નથી
સિવાય કે અલ્લાહ વડે. અને તમામ વખાણ અલ્લાહ
માટે છે (જે) સૃષ્ટિનો પાલનહાર છે.

રજ્યના તકખલ મીના ઈન્ક અન્ત સ્સમીઉલ અલીમ
અલ્લાહુમ સલ્લે અલા મોહમ્મદી વ આલે મોહમ્મદ